MTAR TECHNOLOGIES LIMITED ✓ EBITDA of Rs. 120.9 Cr for FY 2024-25 Registered and Corporate Office: 18, Technocrats Industrial Estate, Balanagar, Hyderabad 500 037, Telangana, India; Tel: +91 40 4455 3333; E-mail: naina.singh@mtar.in; Website: www.mtar.in; Corporate Identity Number: L72200TG1999PLC032836 Extract of Audited Financials Results for the Quarter Ended and Year ended 31st March 2025 (Amount in INR in Crores) STANDALONE CONSOLIDATED **Particulars** Quarter ended Year ended Quarter ended Year ended Quarter ended Quarter ended 31 Mar, 2025 31 Mar, 2024 31 Mar, 2025 31 Mar, 2024 31 Mar. 2029 681,14 681.69 143.50 183.12 143.35 Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or 72.46 18.62 7.19 18.99 72.46 7.41 18.62 71.57 7.19

Extraordinary items#) Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/o Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or 53.85 5.07 13.72 52.59 4.87 Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) 13.42 53.55 5.15 52.59 4.96 for the period (after tax) and Other Comprehensive Income (after tax 30.76 30.76 30.76 30.76 Equity Share Capital 30.76 30.76 Earnings Per Share (of Rs. 10 /- each) (for continuing and discontinued operations) -4.62 4.62

Note: The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements Regulations, 2015. The full format of the Quarterly-Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) www.nseindia.com and www.bseindia.com and on company websites www.mtar.in.

Place: Hyderabad Date: 22 May 202

**PSP** 

S. L No.

**PSP Projects Limited** 

Parvat Srinivas Reddy

Managing Director DIN: 00359139

CIN:L45201GJ2008PLC054868 Registered Office: PSP House, Opp. Celesta Courtyard, Opp. Lane of Vikram Nagar Colony, Iscon-Ambli Road, Ahmedabad - 380 058 Website: www.pspprojects.com

## AUDITED FINANCIAL RESULTS (STANDALONE & CONSOLIDATED) FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2025

The Board of Directors of the Company, at their Meeting held on May 23, 2025 approved the Audited Financial Results (Standalone & Consolidated) for the quarter and year ended March 31, 2025.

The results, along with the Auditor's Report, have been posted on the Company's website at https://www.pspprojects.com/financial-performance/ and can be accessed by scanning the QR code.

Note: The above intimation is in accordance with Regulation 33 read with Regulation 47(1) of the SEBI (Listing Obligation & Disclosure Requirements) Regulations, 2015. For and behalf of Board of Directors

of PSP Projects Limited Sd/-Place: Ahmedabad

Prahaladbhai S. Patel Date: May 23, 2025 Chairman, Managing Director & CEO, DIN: 00037633



SHARE INDIA SECURITIES LIMITED

CIN: L67120GJ1994PLC115132

Registered Office: Unit No. 615 and 616, 6th Floor, X-Change Plaza, Dalal Street Commercial Co-operative Society Limited, Road 5E, Block-53, Zone 5, Gift City, Gandhinagar, Gujarat-382050 Corporate Office: A-15, Sector-64, Noida, Distt. Gautam Buddha Nagar, Uttar Pradesh-201301

Tel: 0120-4910000, 0120-6910000; Fax: 0120-4910030; F-mail ID: secretarial@spaceindia.com Tel.: 0120-4910000, 0120-6910000; Fax: 0120-4910030; E-mail ID: secretarial@shareindia.com; Website: www.shareindia.com

## STATEMENT OF AUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND FINANCIAL YEAR ENDED **MARCH 31, 2025**

The Board of Directors of the Company, at its Meeting held on May 23, 2025 approved the audited Standalone and Consolidated Financial Results for the guarter and financial year ended March 31, 2025. The results, along with the Auditors' Reports, have been posted on the Company's website at

> https://www.shareindia.com/wp-content/uploads/data/uploads/ Investor\_Relations\_Files/financialsmay202522052025.pdf and can be accessed by scanning the QR Code.

KLM AXIVA FINVEST LIMITED

Regd. Office: P.N.39, D.N.8-13, 1st Floor, Ashoka Complex, Mythripuram Colony, Gayathri Nagar X Road, Vaishalinagar P.O.

Hyderabad, Rangareddi, Telangana - 500079. Telephone No: 0484-4281199 Website: https://www.klmaxiva.com|| Email: secretarial@klmaxiva.com Corporate Identity Number: U65910TG1997PLC026983 NOTICE OF THE EGM - E-VOTING AT THE EGM Notice is hereby given that the Extra Ordinary General Meeting (EGM) of the Company will be held on Monday, 16th June, 2025 at 02.30 P.M. (IST), through video conference/other audio visual means in compliance with all applicable laws and General Circulars Issued by the Ministry of Corporate Affairs ('MCA'), Government of India and Securities and Exchange Board of India ('SEBI') to

Electronic copies of the Notice of EGM have been sent to all the members whose email IDs are registered with the Company, Depository participant(s). The same is also available on Company's website at www.klmaxiva.com. Members are requested to note that the physical copies of the aforesaid documents will not be made available to them by the Company. The dispatch of Notice has

In compliance with Section 108 of the Companies Act, 2013, read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, the members are provided with the facility to cast their vote electronically for business that is mentioned in the Notice of

The remote e-voting shall commence on Friday, June 13, 2025 (9.00 a.m.) and end on Sunday, June 15, 2025 (5.00 p.m.). The cut-off date for determining the eligibility for e-voting is Monday, June 09, 2025. The remote e-voting module shall be disabled after 5.00 p.m. on Thursday, March 06, 2025 and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently. The members who have cast their votes by remote e-voting prior to the EGM may also attend the EGM but shall not be

The facility for e-voting will be made available during the EGM, and those shareholders present in the EGM through VC/OAVM facility, shall be eligible to vote through the e-voting system at the EGM. Only persons whose names are recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date i.e. Monday, June 09, 2025 shall be entitled to avail the facility of remote e-voting at the EGM. The voting right of shareholders shall be in proportion to their share in the paid-up

The shareholders can join the EGM in the VC/OAVM mode 15 minutes before the scheduled time of the commencement of the

Meeting by using the remote e-voting login credentials and by following the procedure mentioned in the Notice. The facility to join

Any person, who acquires shares of the company and becomes a shareholder post-dispatch of the Notice of the EGM and holds shares as

on the cut-off date i.e. Monday, June 09, 2025, may obtain the login ID and password by sending a request to evoting@nsdl.com. However, it

Members holding shares in dematerialized mode are requested to register their email addresses and mobile numbers with their

relevant depositories through their depositary participants. Members holding shares in physical mode are requested to furnish their

email addresses and mobile numbers with the Company's Registrar and Share Transfer Agent M/s. KFIN Technologies Limited

Members holding shares in physical form who have not registered their mail addresses with the Company/Depositories may obtain

For Physical Shareholders-Please provide necessary details like Folio No., Name of the shareholder, scanned copy of the share

certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of AADHAR card)

For Demat Shareholders-Please provide Demat account details (CDSL-16-digit beneficiary ID or NSDL-16-digit DPID

+CLID), Name, Client master or copy of consolidated Account statement, PAN (Self attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of AADHAR card) by email to Company at secretarial@klmaxiva.com or with your

n case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders

The Company has appointed CS Nikhil George Pinto, Partner, CaesarPintoJohn & Associates LLP, Company Secretaries, Kochi, as

The results of e-voting will be announced by the Company on its website www.klmaxiva.com and also to stock exchanges at www.bseindia.in.

For and on behalf of KLM Axiva Finvest Limited

Shibu Theckumpurath Varghese

Whole time Director

(DIN: 02079917)

available at the download section of www.evoting.nsdl.com or call on.: 022 - 4886 7000 or send a request to evoting@nsdl.com.

the scrutinizer to scrutinise the e-voting process and poll at EGM in a fair and transparent manner.

by email to Company at secretarial@klmaxiva.com or to Registrar & Share Transfer Agent at compliance.corp@kfintech.com.

a person is already registered with NSDL for e-voting, then the existing user ID and password can be used for casting their vote.

the Meeting through remote evoting (prior to EGM) and evoting (during EGM) through services provided by NSDL



transact the business that is mentioned in the Notice of the Meeting.

been completed on Thursday, May 22, 2025.

equity share capital of the Company as on the cut-off date.

the log in and password for E-voting providing the below necessary details:

through VC/OAVM will be available for shareholders.

respective Depository Participant (DP).

Place: Ernakulam

Date: May 23, 2025

entitled to cast their votes again.

For Share India Securities Limited

Sd/-Sachin Gupta CEO & Whole-Time Director

Place: Noida, Date: May 23, 2025

# **Steel Limited**

CIN: L27102MH1994PLC152925 Registered Office: JSW Centre, Bandra-Kurla Complex, Bandra (E), Mumbai - 400 051 Tel.: 91 22 42861000 Fax: 91 22 42863000 Email: jswsl.investor@jsw.in Website: www.jsw.in

## Extract of Standalone Financial Results for the quarter and year ended 31 March 2025

(Rs in Crores)

Doublevilere		Quarter Ended		Year Ended		
Particulars	31.03.2025	31.12.2024	31.03.2024	31.03.2025	31.03.2024	
	Audited	Unaudited	Audited	Audited	Audited	
Total income from operations	32,471	31,799	35,341	1,27,702	1,35,180	
Net Profit / (Loss) for the period (beforeTax, Exceptional)	2,561	1,741	1,864	7,847	12,141	
Net Profit / (Loss) for the period before tax (after Exceptional)	1,702	1,638	1,624	6,543	12,102	
Net Profit / (Loss) for the period after tax(after Exceptional )	2,047	1,286	1,007	5,837	8,041	
Total Comprehensive Income for the period[Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1,237	307	1,746	6,208	9,938	
Paid up Equity Share Capital	244	244	244	244	244	
Paid up Debt Capital #	11,625	11,625	10,875	11,625	10,875	
Reserves (excluding Revaluation Reserve) as on	79,534	78,319	74,978	79,534	74,978	
Net Worth	72,050	70,036	67,903	72,050	67,903	
Earnings Per Share (of Re.1 each)(not annualised)						
Basic (Rs.)	8.39	5.27	4.13	23.94	33.16	
Diluted (Rs.)	8.37	5.26	4.12	23.87	33.01	
Capital Redemption Reseve	774	774	774	774	774	
Securities Premium	7,742	7,742	7,742	7,742	7,742	
Debt Service Coverage Ratio	2.58	3.45	2.41	2.42	3.05	
Interest Service Coverage Ratio	2.58	3.70	3.79	3.21	4.71	
Debt-Equity Ratio	0.82	0.83	0.78	0.82	0.78	

# represents Listed Debentures

#### Extract of Consolidated Financial Results for the quarter and year ended 31 March 2025

(Pe in Crores

Partiaulara		Quarter Ended		Year Ended	
Particulars	31.03.2025	31.12.2024	31.03.2024	31.03.2025	31.03.2024
	Audited	Unaudited	Audited	Audited	Audited
Total income from operations	44,819	41,378	46,269	1,68,824	1,75,006
Net Profit / (Loss) for the period (beforeTax, Exceptional)	1,774	1,281	2,012	5,566	12,791
Net Profit / (Loss) for the period before tax (after Exceptional)	1,730	1,178	2,012	5,077	13,380
Net Profit / (Loss) for the period after tax (after Exceptional)	1,501	719	1,322	3,491	8,973
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	556	(672)	2,204	3,541	11,050
Paid up Equity Share Capital	244	244	244	244	244
Paid up Debt Capital #	11,625	11,625	10,875	11,625	10,875
Reserves (excluding Revaluation Reserve) as on	79,191	78,733	77,364	79,191	77,364
Net Worth	71,443	70,040	69,669	71,443	69,669
Earnings Per Share (of Re.1 each)(not annualised)					
Basic (Rs.)	6.15	2.94	5.33	14.36	36.34
Diluted (Rs.)	6.14	2.93	5.31	14.32	36.17
Capital Redemption Reseve	774	774	774	774	774
Securities Premium	7,720	7,720	7,720	7,720	7,720
Debt Service Coverage Ratio	2.70	2.27	0.83	1.99	1.83
Interest Service Coverage Ratio	3.22	2.83	3.28	2.90	3.89
Debt-Equity Ratio	1.17	1.14	1.07	1.17	1.07

# # represents Listed Debentures

Date : 23 May 2025

Place: Mumbai

Note: The above is an extract of detailed format of quarterly / yearly Financial Results filed with Stock Exchanges under regulation 33 of the SEBI (Listing and other Disclosure Requirements) regulations ,2015. The Full format of quarterly / yearly Financial Results along with other items referred in regulation 52(4) of the LODR Regulations are available on the Stock Exchange Websites (www.bseindia.com & www.nseindia.com) and Company's Website (www.jsw. in) and can also be accessed by scanning the following Quick Response Code.



For JSW Steel Limited

**JAYANT ACHARYA Jt. Managing Director & CEO** 

# **Ramco Industries Limited**

Regd. Off.: 47, P.S.K.Nagar, Rajapalayam 626 108.

Corporate Off.: "Auras Corporate Centre", 98-A, Dr. Radhakrishnan Road, Mylapore, Chennai - 4.

Rs. In Lakhs

CIN: L26943TN1965PLC005297; WEBSITE: www.ramcoindltd.com EXTRACT OF AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER / YEAR ENDED 31.03.2025

				Quarter Ended	Year Ended		
		Particulars	31.03.2025 Audited	31.12.2024 Un-audited	31.03.2024 Audited	31.03.2025 Audited	31.03.2024 Audited
- [	1	Income from Operations	41,866	34,368	36,491	165,867	150,132
	2	Net Profit/(loss) for the period (before tax, Exceptional and /or Extraordinary items)	3,513	2,718	2,798	14,178	10,851
	3	Net Profit/(loss) for the period (before tax, after Exceptional and /or Extraordinary items)	3,513	2,718	2,798	14,178	10,851
	4	Net Profit / (Loss) for the period (after tax, after Exceptional and / or Extraordinary items)	2,859	1,562	1,968	9,365	7,297
	5	5 Share of Net profit After Tax (PAT) of Associates accounted for using the equity method		7,327	2,413	8,726	3,275
	6	Total Comprehensive Income for the period (Comprising Net Profit for the period after tax and other Comprehensive Income after tax)		13,139	4,083	17,369	17,749
[	7	7 Paid up Equity share capital		866	835	866	835
	8	Other Equity				422,401	405,222
	9	Earnings Per share of Re.1/- each (Rs.) (Not annualised) Basic:	4.12	10.27	5.25	20.89	12.67

Notes:

Diluted:

1. The above is an extract of the detailed format of Quarterly/Yearly Financial Results filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations 2015. The full format of the Financial Results are available on the Bombay Stock Exchange website (URL: www.bseindia.com/corporates), the National Stock Exchange website (URL: www.nseindia.com/corporates) and on the Company's website (URL: www.ramcoindltd.com).

4.12

10.27

5.25

2. The Board of Directors have recommended a dividend of Re. 1/- per equity share of Re.1/- each for the financial year 2024-25.

3. Key informations on Standalone Audited Financial Results: Rs. In Lakhs Quarter Ended Year Ended Particulars 31.03.2025 31.03.2025 31.12.2024 31.03.2024 31.03.2024 **Un-audited** Audited Audited Audited Audited Income from Operations 34,132 27,217 31,113 138,702 129,852 Net Profit / (Loss) for the period (after tax, after 1,342 1,293 479 8,836 5,960 Exceptional and / or Extraordinary items) 261 8,398 7,970 Total Comprehensive Income for the period (2,746)4,981 (Comprising Net Profit for the period after tax and

4. The previous period figures have been re-grouped / restated wherever considered necessary.

QR scan for detailed Financial Results

other Comprehensive Income after tax)



For Ramco Industries Limited P.R. VENKETRAMA RAJA Chairman DIN: 00331406

20.89

12.67





Chennai

23.05.2025



Quarter Ended Year Ended Quarter Ended Year Ended

SHARE INDIA SECURITIES LIMITED

CIN: L67120GJ1994PLC115132

Registered Office: Unit No. 615 and 616, 6th Floor, X-Change Plaza, Dalal Street Commercial
Co-operative Society Limited, Road 5E, Block-53, Zone 5, Gift City, Gandhinagar, Gujarat-382050
Corporate Office: A-15, Sector-64, Noida, Distt. Gautam Buddha Nagar, Uttar Pradesh-201301
Tel.: 0120-4910000, 0120-6910000; Fax: 0120-4910030; E-mail ID: secretarial@shareindia.com;
Website: www.shareindia.com

#### STATEMENT OF AUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND FINANCIAL YEAR ENDED **MARCH 31, 2025**

The Board of Directors of the Company, at its Meeting held on May 23, 2025 approved the audited Standalone and Consolidated Financial Results for the quarter and financial year ended March 31, 2025. The results, along with the Auditors' Reports, have been posted on the Company's website at

> https://www.shareindia.com/wp-content/uploads/data/uploads/ Investor\_Relations\_Files/financialsmay202522052025.pdf

and can be accessed by scanning the QR Code.



For Share India Securities Limited

Sachin Gupta **CEO & Whole-Time Director** 

Place: Noida, Date: May 23, 2025

# **PSP**

## **PSP Projects Limited**


CIN:L45201GJ2008PLC054868

Registered Office: PSP House, Opp. Celesta Courtyard, Opp. Lane of Vikram Nagar Colony, Iscon-Ambli Road, Ahmedabad - 380 058

Website: www.pspprojects.com

#### **AUDITED FINANCIAL RESULTS (STANDALONE & CONSOLIDATED)** FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2025

The Board of Directors of the Company, at their Meeting held on May 23, 2025 approved the Audited Financial Results (Standalone & Consolidated) for the quarter and year ended March 31,



Note: The above intimation is in accordance with Regulation 33 read with Regulation 47(1) of the SEBI (Listing Obligation & Disclosure Requirements) Regulations, 2015.

For and behalf of Board of Directors of PSP Projects Limited

Sd/-

Place: Ahmedabad Prahaladbhai S. Patel Date: May 23, 2025 Chairman, Managing Director & CEO, DIN: 00037633

#### **OSWAL LEASING LIMITED**

Regd. Office: 105, Ashoka Estate, 24, Barakhamba Road, New Delhi-110001 CIN: L65910DL1983PLC016036, Phone: (011) 23313955, Fax: (011) 23316374 Email: oswal leasing@owmnahar.com, Website: http://owmnahar.com/leasing ltd/about.ph Statement of Audited Financial Results for the Quarter & Year ended 31/03/2025

Sr. Particulars		uarter Ende	Quarter Ended			
	31.03.2025 Audited	31.12.2024 Unaudited	31.03.2024 Audited	31.03.2025 Audited	31.03.2024 Audited	
Total Income from operations (net)	4.25	3.26	3.71	15.09	15.29	
Net profit/(Loss) for the period	(0.39)	(1.02)	(0.62)	(2.16)	(3.94)	
(before tax)						
Net profit/(Loss) for the period	(0.39)	(1.02)	(0.62)	(2.16)	(3.94)	
(after tax)						
Total Comprehensive Income/(Loss)	-	-	-	4.95	3.96	
for the period (Comprising Profit/						
(Loss) for the period (after tax) and						
other Comprehensive Income/						
(Loss) (after tax)}						
Equity equity share capital	50.00	50.00	50.00	50.00	50.00	
(Face value : Rs.10/- per share)						
Reserves (excluding revaluation	-	-	-	-	-	
reserve as shown in the per audited						
balance sheet of previous year)						
Earning per share (EPS) (Rs.)						
Basic and Diluted EPS	(0.08)	(0.20)	(0.12)	(0.43)	(0.84)	
	Total Income from operations (net) Net profit/(Loss) for the period (before tax) Net profit/(Loss) for the period (after tax) Total Comprehensive Income/(Loss) for the period (Comprising Profit/ (Loss) for the period (after tax) and other Comprehensive Income/ (Loss) (after tax)} Equity equity share capital (Face value : Rs. 10/- per share) Reserves (excluding revaluation reserve as shown in the per audited balance sheet of previous year) Earning per share (EPS) (Rs.)	31.03.2025 Audited Audited Total Income from operations (net) Net profit/(Loss) for the period (before tax) Net profit/(Loss) for the period (after tax) Total Comprehensive Income/(Loss) for the period (Comprising Profit/ (Loss) for the period (after tax) and other Comprehensive Income/ (Loss) (after tax)} Equity equity share capital (Face value : Rs.10/- per share) Reserves (excluding revaluation reserve as shown in the per audited balance sheet of previous year) Earning per share (EPS) (Rs.)	31.03.2025   31.12.2024   Audited   Unaudited   Unaudited   Unaudited   Unaudited   Unaudited   Unaudited   (0.39)   (1.02)   (before tax)   (0.39)   (1.02)   (after tax)   (0.39)   (0.39)   (1.02)   (after tax)   (0.39)   (0	31.03.2025   31.12.2024   31.03.2024   Audited   Audited   Audited   Audited   Audited   Audited   Audited   Audited   Audited   (before tax)   (0.39)   (1.02)   (0.62)	31.03.2025   31.12.2024   31.03.2024   Audited   Audit	

Notes: 1. The above financial results have been audited by the Statutory Auditors of the Company and reviewed by the Audit Committee and taken on record by the Board of Directors of the company at their meeting held on 22.05.2025. 2. The above Financial Results have been prepared in accordance with the recognition and measurement principles laided down in Indian Accounting Standards 34 (Ind AS-34) prescribed us 133 of the Companies Act, 2013 and discharged and is in compliance with the presentation and disclosure requirements of Regulation 33 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015 (as amended), including relevant circulars issued by the SEBI from time to time. 3. The financial results have been arrived after considering provision for standard assets as per RBI guidelines. 4. The figures of previous periods have been regrouped/recasted/marranged, wherever necessary, to make them comparable. 5. Impact of IND AS on the Fair used of unlisted shares is to be given on yearly basis as it is not possible to calculate the fair value on quaterly basis. 6. Figures for the quarter ended 31 March, 2025 and 31 March, 2024 as reported in these financial results are the balancing figures between audited figures in respect of full financial year and the published year to date figures upto the third quarter of the financial year. Also, the figures upto the end of the third quarter were only reviewed and not subjected to audit.

Date: 22.05.2025



(Kamal Oswal

DIN: 0049321

1/2	Chola		<b>લમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ</b> <b>ોફિસ</b> : ચોલા ક્રેસ્ટ, સીપર		<b>કંપની લિમીટેડ</b> ૧ બી-૪, થીરૂ વી કા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ,ગુઈન્દી, ચેન્નાઈ-૬૦૦૦૩૨, ભ	15d	
	Enter a better life		સિક્ચોરીટ	ાઈઝેશન એન્ડ રી	કિન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને સ્ટ એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩(૨) હેઠળ માંગણા નોટીસ.		
દેવાદાર(રો)નું નામ અને સરનામું					સુરક્ષિત મિલકત		
		એ			બી		
	મહમદઅલી રામાણી,				બિનખેતીલાચક જમીન મિલકત ના તમામ ભાગ અને પાર્સલ	। भेनो हुङान	
	ઈ, કચ્છ, ગુજરાત-૩				નં. ૨(જી.એફ.) ઉપર પ્લોટ નં. ૯ અને ૧૦ આર.એસ. નં.	૧૬૭/૪ અને	
	જી/એફ, પ્લોટ નં. ∈્				પ્લોટ નં. ૨૩, પૈકી આ૨. એસ. નં. ૧૬૭/૧, ક્ષેત્રફળ આ	શર્ટ ૨૮૦.૦૦	
	કપાયા, મુંદ્રા, કચ્છ				ચો. ફૂટ, કોમર્શિચલ હેતુ માટે, નાના કપાચા ગામમાં,	મુન્દ્રા-કચ્છ,	
	રપરા, કચ્છે ગુજરાત				દિલશાદ મમદ વલીમમદ ખોજાની માલિકી છે. જેની <b>ચતુઃર્સ</b>		
ફાઉન્ટેઈન કોમ્પલેક્ષ, ખોડીચાર પેટ્રોલીચમ પંપ પાસે, શક્તિનગર, મુંદ્રા, ક				મુંદ્રા , કચ્છ ,	ઉકત રૂમનો દરવાજો , <b>દક્ષિણઃ</b> ઉકત રૂમની અન્થ મિલકત	, <b>પૂર્વઃ</b> દુકાન	
ગુજરાત-૩૭૦૪૨૧					नं. 3 , <b>पश्चिमः</b> हुङ।न नं. १		
લોનની તારીખ	ખાતા નંબર	લોનની રકમ	માંગણા નોટીસની તારીખ		બાકી લેણાંની રકમ	એનપીએ તારીખ	
સી	કી	Ą	એફ		প্র	એચ	
31/08/2023	HE01GIM00000049802	Rs. 26,88,000/-	29/04/2025	<b>ŞI.</b> 25,99,660	N <b>-તા. 29/04/2025</b> મુજબ વ્યાજના કરારી દરે આગળના વ્યાજ સહિત	05-04-2025	
					કુલ બાકી નીકળતી ૨કમ (રૂપિયામાં) 25,99,660/-		
2	દેવાદાર(રો)	તું નામ અને સરલ	નામું		સુરક્ષિત મિલકત		
		એ			<u> </u>		
	પ્રેન રામનિવાસ ચાદ				ોલાયક મિલકત જેનો દુકાન નં. ૨, (જી.એફ.) ઉપર જન		
	ચ્છ <u>,</u> ગુજરાત-390૪				નું ક્ષેત્રફળ આશરે 39 ૭૫ ચોરસ મીટર,(જમીનમાં અવિભ		
	બિલ્ડીંગ, ગ્રાઉન્ડે ફ્લોર, દુકાન નં. ૨, ગામ ઘેબ, તા. મુંદરા, જી. 🤄 ઉપ૪ ચોરસ મીટર, સુપર બિલ્ટઅપ વિસ્તાર ૩૮ દુફ ચોરસ મીટર), પ્લોટ નં. ૦૦						
	ત્રાત-૩૭૦૪૨૧ <b>૨.</b> '	पवन रामनिवार	<b>ન ચાદવ,</b> પ્લોટ નં. ૧	૨, પરબાંધ	ાવામાં આવેલ, ક્ષેત્રફળ આશરે ૯૫૩.૭૦ ચોરસ મીટરનું, રે	वन्यु सर्वे नं .	
જલારામ ર	rરાત-390૪૨૧ <b>૨.</b> ૧ સોસાચટી, બરોઈ, ક	<mark>પવન રામનિવાર</mark> કચ્છ, ગુજરાત-	<b>ા ચાદવ,</b> પ્લોટ નં.૧ ૩૭૦૪૨૧ <b>૩. શ્રી ૨</b>	.૨, પરબાંધ થ <b>દો</b> ૧૬૯/૧૮	: માં, "કોસ્ટા રિકા-ર" ગામઃ ધ્રાબ, મુન્દ્રા કચ્છ (ગુજરાત	વન્યુ સર્વે નં. ) માં સ્થિત ,	
જલારામ ર <b>લોજીસ્ટીક</b>	'રાત-૩૭૦૪૨૧ <b>૨.</b> ' સોસાચટી, બરોઈ, ક <b>,</b> પ્લોટ નં. ૨૫, શક્રિ	<b>पवन रामनिवार</b> इच्छ, गुषरात- तेनगर मिर्गा	<b>ા ચાદવ,</b> પ્લોટ નં. ૧ ૩૭૦૪૨૧ <b>૩. શ્રી ૨</b> કોર્ન૨, નાના કપાર	.૨, પર બાંધ શ <b>હે</b> ૧૬૯/૧૮ યા, ચાદવ સ	: માં, "કોસ્ટા રિકા-૨" ગામઃ ધ્રાબ, મુન્દ્રા કચ્છ (ગુજરાત રોજબેન રામનિવાસની માલિકીની છે.જેની. <b>ચતુઃસીમા</b> : ઉ	વન્યુ સર્વે નં. ) માં સ્થિત , કેતર : દુકાન	
જલારામ <b>લોજીસ્ટીક</b> મુંદ્રા, જી.	ત્ટાત-૩૭૦૪૨૧ <b>૨.</b> ૧ સોસાચટી, બરોઈ, ક ,પ્લોટ નં. ૨૫, શક્રિ કચ્છ, ગુજરાત-૩૭૦	<b>પવન રામનિવાર</b> કચ્છ, ગુજરાત- તેનગર મિરઝા ૪૪૨૧ . <b>૪. રામ</b> િ	<b>ત યાદવ,</b> પ્લોટ નં.૧ ૩૭૦૪૨૧ <b>૩. શ્રી ૨</b> કોર્ન૨, નાના કપા <b>ટ</b> <b>નેવાસ માતૃમલ યાદ</b>	ર, પરબાંધ શ <b>દો</b> ૧૬૯/૧૮ યા, ચાદવ સ <b>.વ,</b> નં. ૩, <b>દ</b>	: માં, "કોસ્ટા રિકા-ર" ગામ: ઘ્રાળ, મુન્દ્રા કચ્છ (ગુજરાત ારોજબેન રામનિવાસની માલિકીની છે. જેની. <b>ચતુ:સીમા : ઉ</b> દ <b>િકાય:</b> દુકાન નં. ૧, <b>પૂર્વ:</b> દુકાનનો પાર્કિંગ વિસ્તારનો પ્રત	વન્યુ સર્વે નં. ) માં સ્થિત , કેતર : દુકાન	
જલારામ <b>લોજીસ્ટીક</b> મુંદ્રા, જી.	ત્રાત-૩૭૦૪૨૧ <b>૨.</b> સોસાચટી, બરોઇ, ક ,પ્લોટ નં. ૨૫, શક્તિ કચ્છ, ગુજરાત-૩૭૦ ૨,જલારામ સોસાચટ	<b>પવન રામનિવાર</b> કચ્છ, ગુજરાત- તેનગર મિરઝા ૪૪૨૧ . <b>૪. રામ</b> િ	<b>ત યાદવ,</b> પ્લોટ નં.૧ ૩૭૦૪૨૧ <b>૩. શ્રી ૨</b> કોર્ન૨, નાના કપા <b>ટ</b> <b>નેવાસ માતૃમલ યાદ</b>	ર, પરબાંધ શ <b>દો</b> ૧૬૯/૧૮ યા, ચાદવ સ <b>.વ,</b> નં. ૩, <b>દ</b>	: માં, "કોસ્ટા રિકા-૨" ગામઃ ધ્રાબ, મુન્દ્રા કચ્છ (ગુજરાત રોજબેન રામનિવાસની માલિકીની છે.જેની. <b>ચતુઃસીમા</b> : ઉ	વન્યુ સર્વે નં. ) માં સ્થિત , કેતર : દુકાન	

ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની લિમીટેડ

**રા.** 15,40,921/- **તા.** 29/04/2025 મુજબ વ્યાજના કરારી દરે આગળના વ્યાજ સહિત

**કુલ બાકો નીકળતી રકમ (રૂપિયામાં)15,40,921/-**ક્યોરીટાઇઈ)શન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાનિસ્થલ એસેટ્સ અને એનફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ રચાયેલ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એનફોર્સમેન્ટ) નિયમોના નિયમ ર(એ) હેઠળ નીચે સહી કરનાર **યોલામંડલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સ કંપની લીમીટેડ** અહી પછી સિક્યોર્ડ લેણદાર કહેવાયેલ છે ના અધિકૃત અધિકારી છે. જે અન્યચે કોલમ (એ) માં જણાવેલ દેવાદારો/સહ -દેવાદારો/જામીનદારો કોલમ નં.(બી)માં જણાવેલ સુરક્ષીત મિલકત, કોલમ (સી) માં જણાવેલ લોનની તારીખ, કોલમ (ડી) માં જણાવેલ ખાતા નંબર કોલમ (ઇ) માં જણાવેલ લોનની રકમ કોલમ (એફ) માં જણાવેલ માંગણા નોટીસની તારીખ કોલમ (જી)માં જણાવેલ બાકી લેણાંની રકમ કોલમ (એચ)માં જણાવેલ એન્પીએની તારીખ, આપેલ ટાઇટલ ડીડના જમા દ્વારા કોલમ (જી)માં કાનુની ગીરો લોનની બાકી

સુલાત માટે રચાચો હતો. પહુલાત માટે સ્થાયો હતા. દેવાદાઓલા લીલા એકાઉટમાં લોનાની પરત ચુકવાણીના કિસ્સામાં કસુરના પગલે રીઝર્વ બેંક એફ ઇન્ડિયાના નિર્દેશ અને માર્ગદર્શનો મુજબ સિક્યોર્ડ લેઇદારે દેવાદાઓલા લીલા એકાઉટ્યોમાં લોનાની મુજબ સિક્યોર્ડ લેઇદારે નોના પરફોમિંગ એસેટ કોલમ (એસ) ત્યારે હવાદાએને નોટીસ પણ જાર્ર કરાઇ હતી. જે બજાવળી વગર પરત કરી હતી. જણાવવાનું કે તમે સિક્યોરીટાઇઝેશન એક્ટની કલમ ૧૩ (૮) હેઠળ વેચાણની જાહેરાત પહેલા તમામ કોસ્ટર, ચાર્જ અને ખરા સહીતની સંપુર્થ બાલી વગર પરત કરી હતી. જણાવવાનું કે તમે સિક્યોરીટાઇઝેશન એક્ટની કલમ ૧૩ (૮) હેઠળ વેચાણની જાહેરાત પહેલા તમામ કોસ્ટર, ચાર્જ અને ખરા સહીતની સંપુર્થ બાબતોને ધ્યાનમાં રાખીને, સરદરહું દેવાદારોને નોટીસની તારીખથી ૬૦ દિવસની અંદર અતિમ તારીખ સુધીના વ્યાજ, કોસ્ટ અને ચાર્જ સહીત ઉપર કોલગ (જી)માં દર્શાવિત સંપુર્થ બાકી રક્મ ચુકવીને સિક્યોર્ડ લેઇદાર તરફી તેમની સંપુર્થ જવાબદારીમાંથી છુટકારો મેળવવા જણાવવામાં આવે છે, જેમાં નિષ્ફળ જતાં, લેઇદાર સિક્યોર્ડ એસેટનો કબજો તેવા ક્લાઇવાઈ પણ કરી શક્યો. સિક્યોર્ડ એસેટની તબહીલીની મંજૂર હોય અપ્યાર્થ કરકા મહાવાઈ પણ કરી શક્યો. પણ કરીના સ્થાપ કરા કાલ્યા હોય સાથે કોયા સ્થાપના કરકા સ્થાપના કરકા સ્થાપના સ્થાપના માને સાથે બોલ સ્થાપના સ્થાપના કરકા સ્થાપના કરકા મહાવા કરા સાથે ક્યાર સાથે કરા સાથે કારો કોયા પણ કરી શક્યો. પણ હોયા સ્થાપના કરકા સ્થાપના કરકા સાથે કોય સાથી અન્ય કાર્યા કરી કર્યા કરા કરા સાથે કાર્યા કરી સાથે સ્થાપના કરકા સ્થાપના કરકા સાથે કોયા સાથે કે કારો સાથે કોયા સ્થાપના કરકા કરો કે ત્યારા કરા કરો કરા કોયા કરી કોયા કરી કારો સાથે કારો કોયા કરા કરા કારો કોયા કરવા કરી કારો કોયા કરા કારો કોયા કરી કારો કોયા કરી કારો કોયા કરી કારો કોયા કોયા કરા કરો કોયા કોયા કરી કારો કોયા કારો કોયા કારો કારો કોયા કોયા કારો કારો કોયા કોયા કોયા કારો કોયા કોયા કારો કોયા કારો કારો કારો કાયા કારો કારો કોયા કારો કોયા કોયા કોયા કારો કારો કોયા કારો કોયા કારો કોયા કોયા કારો કોયા કારો કોયા કારો કોયા કોયા કારો કોયા કારો કોયા કારો કારો કોયા કારો કોયા કારો કારો કોયા કોયા કોયા કારો કારો કોયા કારો કારો કોયા કારો કારો કોયા કારો કોયા કારો કારો કોયા કારો કોયા કારો કોયા કારો કોયા કારો કારો કારો કારો કારો કારો કારો કાયા કારો કારો કારો કાયા કારો કાયા કારો કારો કાયા કારો કાયા કારો કાયા કારો કારો કાયા કાયા કાયા

પછી પણ બાકી રકમમાંથી સંપુર્ણ છુટકારો ન મળતા સિક્ચોર્ડ લેણદાર લોન એગ્રીમેન્ટ મુજબ સોલ આર્બીટ્રેટર સમક્ષ દેવાદારો સામે પગલા લેવાનો અનામત હક ધરાવે વધુમાં , સદરહુ દેવાદારોને સિક્ચોર્ડ લેણદારની આગોતરી લેખીત મંજુરી વગર કોઇપણ રીતે દેવાદારોના નામ સામે કોલમ (**બી)** માં જણાવેલ સિક્ચોર્ડ એસેટનું વેચાણ ભાડે અથવા અન્ય રીતે તબદીલ કરવા અથવા ત્રાહીત વ્યક્તિનું હિત સર્જવા અથવા અન્ય રીતે સોદો કરવાની મનાઇ ફરમાવામાં આવે છે. **સહી/ અધિકૃત અધિકૃત** 

રીખ : ૨૩.૦૫.૨૦૨૫ 💮 નોંધ : વિવાદની સ્થિતીમાં આ નોટીસનો અંગ્રોજી અનુવાદ માન્ય ગણાશે. ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની લિમીટે

## Ramco Industries Limited

Regd. Off.: 47, P.S.K.Nagar, Rajapalayam 626 108.

Corporate Off.: "Auras Corporate Centre", 98-A, Dr. Radhakrishnan Road, Mylapore, Chennai - 4. CIN: L26943TN1965PLC005297; WEBSITE: www.ramcoindltd.com

#### Rs. In Lakhs EXTRACT OF AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER / YEAR ENDED 31.03.2025

			Quarter Ended		Year Ended		
	Particulars	31.03.2025 Audited	31.12.2024 Un-audited	31.03.2024 Audited	31.03.2025 Audited	31.03.2024 Audited	
1	Income from Operations	41,866	34,368	36,491	165,867	150,132	
Net Profit/(loss) for the period (before tax, Exceptional and /or Extraordinary items)		3,513	2,718	2,798	14,178	10,851	
Net Profit/(loss) for the period (before tax, after Exceptional and /or Extraordinary items)		3,513	2,718	2,798	14,178	10,851	
4	Net Profit / (Loss) for the period (after tax, after Exceptional and / or Extraordinary items)	2,859	1,562	1,968	9,365	7,297	
5	Share of Net profit After Tax (PAT) of Associates accounted for using the equity method	712	7,327	2,413	8,726	3,275	
6	Total Comprehensive Income for the period (Comprising Net Profit for the period after tax and other Comprehensive Income after tax)	(1,132)	13,139	4,083	17,369	17,749	
7	Paid up Equity share capital	866	866	835	866	835	
8	Other Equity				422,401	405,222	
9	Earnings Per share of Re.1/- each (Rs.) (Not annualised)						
	Basic:	4.12	10.27	5.25	20.89	12.67	
	Diluted:	4.12	10.27	5.25	20.89	12.67	

### Notes

Chennai

23.05.2025

- 1. The above is an extract of the detailed format of Quarterly/Yearly Financial Results filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations 2015. The full format of the Financial Results are available on the Bombay Stock Exchange website (URL: www.bseindia.com/corporates), the National Stock Exchange website (URL: www.nseindia.com/corporates) and on the Company's website ( URL: www.ramcoindltd.com).
- 2. The Board of Directors have recommended a dividend of Re. 1/- per equity share of Re.1/- each for the financial year 2024-25. 3. Key informations on Standalone Audited Financial Results: Rs. In Lakhs
- Quarter Ended Year Ended Particulars 31.03.2025 31.03.2024 31.03.2025 31.03.2024 31.12.2024 Audited Un-audited Audited Audited Audited Income from Operations 34,132 27,217 31,113 138,702 129,852 8,836 Net Profit / (Loss) for the period (after tax, after 1,342 1,293 479 5,960 Exceptional and / or Extraordinary items) (2,746)Total Comprehensive Income for the period 4.981 261 8,398 7.970
- other Comprehensive Income after tax) 4. The previous period figures have been re-grouped / restated wherever considered necessary.

QR scan for detailed Financial Results



(Comprising Net Profit for the period after tax and

For Ramco Industries Limited P.R. VENKETRAMA RAJA Chairman DIN: 00331406

ફાયનાન્સિયલ એક્સપ્રેસ

ફોર્મ નં.-યુઆરસી-્ર અધિનિયમના XXI પ્રકરણના ભાગ I હેઠળ નોંધણી વિશે સૂચના આપતી નોટિસ [કંપની અધિનિયમ, 2013 ની કલમ 374(બી) અને યની (નોંધણી માટે અધિકૃત) નિયમો, 2014ના નિયમ 4(1) ને અનુસરીને

.આથી સૂચના આપવામાં આવે છે કે કંપની એક્ટ, ૨૦૧૩ની કલમ . ત્યાના ત્યુવના આવપાના આવ છ ક કપના અક્ટ, ૨૦૧ વર્ગી કલમ ૩૬૬ની પેટા કલમ (૨)ના અનુસંધાનમાં, અહીંથી પંદર દિવસ પછી પરંતુ ત્યાર પછીના ત્રીસ દિવસની મુદત પૂરી થાય તે પહેલા રજીસ્ટાર, સેન્દ્રલ રજીસ્ટ્રેશન સેન્ટર (સિ.આર.સિ.), ઇન્ડિચન ઇન્સ્ટીટ્યૂટ ઓફ કોપેરિટ અફેર્સ (આઇ. આઇ. સિ. એ.), પ્લોટ નંબર ૬, ૭, ૮, સેન્ટર ૫, આઇ.એમ. દિ. માનેસર, જિલ્લો ગુડગાંવ (હરિચાણા), પિનકોડ-૧૨૨૦૫૦ માં ''મે. જેઆરડી કાર્ડ એલ્ઓલપી (LLPIN): ACF-3761)" શેર દ્વારા મર્યાદિત કંપની તરીકે કંપની એક્ટ ૨૦૧૩ ન ચેપ્ટર XXI ના ભાગ ૧ હેઠળ રજીસ્ટર થનાર છે. કંપાનીના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે: દરેક પ્રકાના એપ્લિકેશન, પ્રોગ્રામ, મોબાઈલ એપ્લિકેશન, વેબ અપ્લિકેશન, ઉત્પાદન, પોર્ટલ, સર્વિસ, એપ્લિકેશન તથા સંબંધિત સેવાઓનું ડેવલપમેન્ટ, પ્રોસેસ, મેન્યુફેક્ચર, તૈયારી અથવા અન્ય રીતે

ત્રવાઓનું ડવલપને દર્શ પ્રકારના હિવાઈસ, કમ્યુટર/પાર્ટ્સ/એક્સેસરીઝ ત્રવાસાય કરવી. દરેક પ્રકારના હિવાઈસ, કમ્યુટર/પાર્ટ્સ/એક્સેસરીઝ તથા સંબંધિત ઉત્પાદનોનું હિઝાઈન, માર્કેટિંગ, બદલાવ તેમજ તેમની સાથે જોડાયેલી સપોર્ટ સેવાઓ, સોલ્યુશન્સ અને કન્સલ્ટિંગ સર્વિસ આપુર્વી. તેમજ હોસ્પિટલ જેવી ઉદ્યોગોએ ઉપયોગી એવી સોક્ટવેર સંબંધિત ઈ-કાર્ડ સેવાઓ પણ પ્રદાન કરવી. સૂચિત કંપનીના ડ્રાફ્ટ મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશનર્ન

નેકલ પ્લોટ નં.-૧, સોનેક્સ ઝિર્કોન નજીક, તાલુકો મોરબી, ગામ

લાલપર, મોરબી, રાજકોટ-૩૬૩૬૪૨, ગુજરાત, ભારત ખાતે તેની ઓફિસમાં નિરીક્ષણ કરી શકે છે. .આથી સૂચના આપવામાં આવે છે કે આ અરજી સામે વાંધો ઉઠાવનાર . ગાયા સુધ્યા ખાવવામાં ખાવ છે કે બો બધ્ય સાથે વાયા ઇઠાવયાન કોઈપણ વ્યક્તિ પોતાનો વાંધો રજીસ્ટાર, સેન્ટ્રલ રજીસ્ટ્રેશન સેન્ટર (સિ. આર. સિ.), ઇન્ડિચન ઇન્સ્ટીટચૂટ ઓફ કોર્પોરેટ અફેર્સ(આઇ.આઇ.સિ.એ.), પ્લોટ નંબર ક, હ, ૮, સેક્ટર પ, આઇ.એમ.ટિ. માનેસર, જિલ્લો ગુડગાંવ (હરિચાણા), પિનકોડ-૧૨૨૦૫૦, આ નોટિસ પ્રસિદ્ધ થવાના ૨૧ દિવસમાં રજૂ કરી શકે છે અને નકલ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસને મોકલાવી શકે છે.

૧. પુનિત વી. પડસુમ્બીયા (નિયુક્ત ભાગીદાર) (DPIN : 10496510

વતિ, જેઆરડી કાર્ડ એલએલપ

ધર્મેશભાઈ એચ. ભાલોડીયા (નિયુક્ત ભાગીદાર) (DPIN : 10496509) તારીખ : ૨૩-૦૫-૨૦૨૫ | સ્થળ : રાજકોટ

**GUJARAT PETROSYNTHESE LIMITED** No. 24, Il Main, Phase I, Doddanekundi Induatrial Area, Mahadevpura Pos Bengaluru - 560048 CIN: L23209KA1977PLC043357 Email: info@gpl.in,

secretarial@quiaratpetrosynthese.com, Website: www.qpl.ir AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31<sup>ST</sup> MARCH 2025

No.	Particulars	31.03.2025	31.03.2025	31.03.2024	31.03.2024
1	Total Income from Operations	54,615	2,01,372	39,829	1,67,895
2	Net Profit / (Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items)	6,006	22,100	772	12,923
3	Net Profit / (Loss) for the period before tax, (after Exceptional and/or Extraordinary items)	6,006	22,100	772	12,923
4	Net Profit / (Loss) for the period after tax, (after Exceptional and/or Extraordinary items)	4,975	14,603	1,354	16,595
5	Total Comprehensive Income for the period {Comprising profit / loss for the period (after tax) & other comprehensive income (after tax)}	4,975	14,603	1,354	16,595
6	Paid up Equity Share Capital (face value Rs.10/- per share)	5,969	5,969	5,969	5,969
7	Reserves (excluding revaluation reserve) as shown in the audited balance sheet of the previous year				4,24,925
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations 1. Basic 2. Diluted	0.83	2.45	0.23	2.78
Н	Z. Dilatoa	0.00	2.40	0.20	2.70

Place: MUMBAI

a) The above is an extract of the detailed format of Financial Results for the quarter and year ended 31st March 2025 which were reviewed by the Audit Committee at Its meeting held on 23th May, 2025 and approved at the neeting of the Board of Directors and filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing an Other Disclosure Requirements) Regulations, 2015. The Statutory Auditors of the Company have carried or mited review of the aforesaid results. The full format of the Financial Results is available on the website of BSE a www.bseindia.com and on Company's website at www.gpl.in. (b) The Company operates in one segment only. c) Figures of the previous quarter/period have been regrouped/rearranged, where ever necessary to make the omparable.

Date: 23/05/2025

FOR GUJARAT PETROSYNTHESE LIMITED

URMI N. PRASAD, JT. MANAGING DIRECTOR, DIN: 00319482

#### INDIA RADIATORS LIMITED

CIN: L27209TN1949PLC000963 Regd. Off: 88, Mount Road, Guindy, Chennai 600 032. Tel: 044-40432210 Email: cs@indiaradiators.com Website: www.indiaradiators.com

#### AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH 2025

In compliance with Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations"), the Board of Directors of India Radiators Limited ("Company") at its meeting held on Friday, 23rd May 2025 approved the Audited Financial results for the quarter and year ended 31st March 2025 ("results").

The results, along with the Audit report by M/s. DPV & Associates, Statutory Auditor of the Company are available on the website of the Company at https://www.indiaradiators.com/others, and on the website of the Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com.

In compliance with Regulation 47 of the SEBI Listing Regulations, we hereby notify that the same can also be accessed by scanning the following Quick Response (QR) code:



For India Radiators Limited

Whole-time Director DIN: 06463753

૦૯.૦૫.૨૦૨૫

E N Rangaswami

🔼 🛮 Indian Bank 🛕 इलाहाबाद ΔΙΙΔΗΔΒΔΟ

Place: Chennai

Date: 23 May 2025

મહાલક્ષ્મી કોમ્પલેક્ષ, પાલડી, અમદાવાદ, ગુજરાત - ૩૮૦૦૦७ માંગણા નોટિસ

જીર, મહાલક્ષ્મી ટાવર-બી, ન્યુ વિકાસ ગૃહ રોડ,

પરિશિષ્ટ-૧ ધી સિક્ચોરિટાઈગ્રેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ની કલમ ૧૩(૨) હેઠળ નોટિસ

. સભાણી ભગવાનભાઈ પ્રભુભાઈ (દેવાદાર / ગીરવેદાર)

રહેણાંક સરનામ (૧) ફ્લેટ નં. ડી-પ૦૧, પાંચમો માળ, અમન ન્યૂ ઈન્ડિયા કોલોની, હાથીજણ, વટવા, નારોલ, અમદાવાદ-૩૮૨૪૪૫ (૨) બી૧૦૪, શ્યામ વન-૧૫, ઓમ સર્કલની પાસે , ટીલાયન્સ પેટ્રોલ પંપની પાછળ , વસ્ત્રાલ , અમદાવાદ-૩૮૨૪૧૮

. સભાણી સંગીતાબેન ભગવાનભાઇ (જામીનદાર)

(૧) ફ્લેટ નં. ડો-૫૦૧, પાંચમો માળ, અમન ન્યુ ઈન્ડિયા કોલોની , હાથીજણ , વટવા , નારોલ , અમદાવાદ-૩૮૨૪૪૫

(૨) બી૧૦૪, શ્યામ વન-૧૫, ઓમ સર્કલની પાસે, રીલાયન્સ પેટ્રોલ પંપની પાછળ, વસ્ત્રાલ, અમદાવાદ-૩૮૨૪૧૮ વિષય : તમારું ઇન્ડિયન બેંક, જુના શારદા મંદિર શાખા સાથે રજી. તમારા હોમ લોન ખાતા નં. હ૪૩૬૯૫૧૬૨૧

તમારામાંથી પ્રથમ વ્યક્તિ હાલમાં અથવા કોઈપણ ભૌતિક સમયે એક વ્યક્તિ તરીકે તમારામાંથી પ્રથમ વ્યક્તિ દ્વારા લેવામાં આવેલા લોન નાતાઓ માટે દેવાદાર છે. પ્રથમ વ્યક્તિ ગીરવેદાર છે જેણે તમારામાંથી પ્રથમ વ્યક્તિ દ્વારા લેવામાં આવેલા લોન ખાતાઓને સુરક્ષા તરીકે બેંકિંગ વ્યવસાય દરમિયાન તમારામાંથી પ્રથમ અને દ્વિતીયની વિનંતી પર, નીચેની સુવિધાઓ મંજૂર કરવામાં આવી હતી અને

ામારામાંથી પહેલા વ્યક્તિ દ્વારા તેનો લાભ લેવામાં આવ્યો હતો . સુવિધા મુજબના બાકી લેણાં નીચે મુજબ છે :

૦૯.૦૫.૨૦૨૫ સદી

ક્રમ નં.	સુવિધાનો પ્રકાર	બાકી રકમ (રૂા. માં)	વ્યાજનો દર	લેટા ઉદ્યારેલ વ્યાજ નહીં ઉદ્યારેલ વ્યાજ	પેનલ વ્યાજ	મુજબ કુલ બાકી (રૂા. માં)
1	IBHL	3 <b>४,४</b> ٩,3૫ <i>۶ -</i>	۷.80%	રૂા. ૧,૦७,૫૦૬/- વત્તા લેણાંની પુરેપુરી અને આખરી પતાવટ સુધી ઉપાર્જીત વ્યાજ	<b>83/</b> -	રૂા. ૩૫,૪૮,૯૦૫/- વત્તા લેણાંની પુરેપુરી અને આખરી પતાવટ સુધી ઉપાર્જીત વ્યાજ
<b>чу</b> с	برجادي وداي	લ્ટ્રેક ગણિલાઓ માટ્ટ થી	ചിപ ചേദിരി	માર્ગ કર્યા છે.		

मार्थित दुर्भाव हर सीचवार्था सार्ट भावणा दस्ताव से पूर्व उचा छ.				
सवसतनो प्रकार	દસ્તાવેજનો પ્રકાર			
૧. ઈન્ડિયન બેંક હોમ લોન	૧. ૨૩.૦૨.૨૦૨૩ ના રોજ કિમાન્ડ પ્રોમિસરી નોટ ૨. ૨૦.૦૫.૨૦૨૩ ના રોજ બેંકના નામે સાદું મોર્ટગેજ/રજિસ્ટર્ડ મોર્ટગેજ કીક			
	3. ૨૩.૦૨.૨૦૨૩ ના રોજ ગેરંટી કરાર			

ઉપરોક્ત લોનની ચુકવણી તમારામાંથી નંબર ૨ દ્વારા ૨૩.૦૨.૨૦૨૩ ના રોજ ગેરંટી કરાર દ્વારા વ્યક્તિગત રીતે ગેરંટી આપવામાં આવે છે ઉપરોક્ત લોનની હું ઉપરોક્ત લોનની હુંકવણી તમારા નં. ૧ ના ફ્લેટ ડી-૫૦૧, ૫મો માળ, અમન એપાર્ટમેન્ટ, ન્યૂ ઇન્ડિયા કોલોની, હાથીજણ, વટવા, નારોલ અમદાવાદ-૩૮૨૪૪૫ ખાતે મિલકતના ગીરવે મૂકીને સુરક્ષિત કરવામાં આવે છે. તમારામાંના દરેક અને પ્રત્યેકે વ્યાજ સહીતની રકમ ચુકવવા માટે વારવારની દરખાસ્તોને અવગણી છે અને સંયુક્ત અને વ્યક્તિગત રીતે

જવાબદારીમાં નિષ્ફળ ગયા છો અને બાકી રકમની ચુકવણીમાં કસુરવાર ઠર્ચા છો. લોન એકાઉન્ટ રીઝર્વ બેક ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલ એસટ્સ વર્ગીક્ટણને સબંધિત નિર્દેશો/માર્ગદર્શનો અનુસા**ર ૦૮.૦૫.૨૦૨૫ થી નોન પરફોર્મિંગ એસેટ** તરીકે વર્ગીકૃત કરાયા છે. \*\*\*તમારા તરફથી ચુકવાપાત્ર બાકી લેણાંની રકમ **૦૯.૦૫.૨૦૨૫ મુજબ રૂા. ૩૫,૪૮,૯૦૫/- (રૂા. પાત્રીસ લાખ અંડતાળીસ હજાર નવસો પાંચ** 

પુરા) છે અને જણાવેલ રકમ પુર્નચુકવણીની તારીખ સુધી ૧૦.૦૫.૨૦૨૫ થી સંમત થયેલા દરે આગળનું વ્યાજ ધરાવે છે. ર્લિક્સોરીટાઇગ્રેશન એન્ડ રીકેન્સ્ટ્રેક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એનફોર્સમેન્ટ ઓફ સિક્સોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ હેઠળ ટર્મ દેવાદાર શબ્દ એટલે કે કોઇ વ્યક્તિ જેણે બેંક પાસેથી નાણાંકિય સહાય મેળવી છે અથવા જેણે કોઇ ગેરંટી આપી છે અથવા કોઇ ગીરો રચ્યો

છે/બેંક દ્વારા મંજુર કરાચેલ નાણાંકિય સહાય માટે સિક્યોરીટી તરીકે ગીરો મુકી છે. આથી, તમોને સોને અને તમારામાંના દરેકને તારીખ મુજબ **રા. ૩૫,૪૮,૯૦૫/- (રા. પાત્રીસ લાખ અડતાળીસ હજાર નવસો પાંચ પુરા)** જેવી બાકી રકમ આ તારીખથી ચૂકવણીની તારીખ સુધીના વ્યાજ સહીત કલમ ૧૩(૨) હેઠળ જારી કરાયેલ આ નોટીસની તારીખથી દૃ૦ દિવસની અંદર ચુકવી જવા માટે જણાવવામાં આવે છે , જેમાં નિષ્ફળ જતાં બેંકને કથિત એક્ટ હેઠળ તમને કોઇ અન્ય નોટીસ આપ્યા વગર એનફોરમિન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટના તેમના હકનો ઉપયોગ કરવાની ફરજ પડશે. જો તમે આ નોટિસની તારીખથી દ૦ દિવસની અંદર તમારા સંપણ બાકી લેણાંમાંથી છુટકારો મેળવવામાં નિષ્ફળ જશો તો અહીં નીચે પરિશિષ્ટમાં આપેલ સિક્ચોર્ડ એસેટોની સામે કાયદાની કલમ ૧૩(૪) હેડ

બેંક તેના એનફોર્સમેન્ટ હકોનો ઉપયોગ કરશે. આ નોટીસની તારીખથી ૬૦ દિવસની પુરા થયે અને માંગણાનું પાલન કરવામાં તમારી નિષ્ફળતા પર, બેંક કાયદા હેઠળના અધિકારોનો

ઉપયોગ કરીને કબજો લેવા આવશ્ચક પગલા લેશે . મહેરબાની કરીને નોંધ લવી કે કાયદાની કલમ ૧૩(૧૩) ની જોગવાઇઓ અનુસાર બેંકની આગોતરી લેખિત મંજુરી વગર આ નોટીસની તારીખ

પછી વેચાણ, ભાડે કે અન્ય રીતે સિક્યોર્ડ એસેટ ( અહીં નીચે પત્રકમાં આપેલ )ની ફેરબદલી કરી શકાશે નહી એ જણાવાની જરૂર નથી કે આ નોટીસ બેંકને પ્રાપ્ત કોઇપણ અન્થ ઉપાયો પ્રત્યે પુર્વગ્રહ વગર તમને સંબોધિત છે. ફૂપા કરી નોંધ લેશો કે અ નોટીસ ડીઆરટી / ડીઆરએટી / કોર્ટના ડીઆરટી / આરઓ સમક્ષ કાર્યવાહીને આગળ વધારવાના બેંકને પ્રાપ્ત કોઇપણ અન્ય ઉપાયો પ્રત્યે

ુ કૃપા કરીને નોંધ લેવી કે બેંકના વટાવગત બાંકી લેણાં , બેંક ગેરેટી અને ક્રેડીટરના પત્ર અને તમારા વતી સ્વીકૃતિ હેઠળ ઉપજેલ લેણાં અને અન્ય ખાકિસ્મક લેણાં ચકવવા માટે તમને જણાવવાનો તેનો હક અનામત રાખે છે

"સરફેસી કાયદાર્ની કલમ ૧૩ (૮) અને તેના હેઠળ બનાવેલા નિયમોની સિક્ચોરીટીઓ પરત મેળવવાના તમારા અધિકારના ઉપયોગની જોગવાઈઓ પ્રત્યે અમે તમારૂ ધ્યાન દોરીએ છીએ."

નીચે સહી કરનાર કથિત એક્ટની કલમ ૧૩ની જોગવાઇઓ હેઠળ સત્તાનો ઉપયોગ કરનાર અને નોટીસ જારી કરનાર અધિકૃત અધિકારી છે*.* 

#### પરિશિષ્ટ એસેટ્સની કેટલીક વિગતો, કે જેના માટે સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ કરવામાં આવ્યું છે તે નીચે જણાવ્યા મુજબ છે.

**ગીરો મિલકતનું વર્ષન :** મિલકતના તમામ પીસ અને પાર્સલ જેનો ફ્લેટ નં. ડી/પ૦૧, પાંચમો માળ, જેનું બાંધકામ અંદાજીત ક્ષેત્રફળ ૯૧.૪૫ ચો.મી. કાર્પેટ એરીચા, ૧૦૪.૮૨ ચો.મી. બિલ્ટ અપ એરીચા, ૩.૨૦ ચો.મી. વોશ એરીચા, ૧૫૪.૪૮ ચો.મી. સુપર બિલ્ટ અપ એરીચા, જમીનના અવિભાજીત હિસ્સાઓ સહિત અંદાજીત ક્ષેત્રફળ ૪૯.૮૬ ચો.મી. જે બીન-ખેતીલાચક સ્કીમ પર બંધાચેલ "અમન" નામની જાણિતી સ્કીમ જેનો અકત્રીક બ્લોક નં. ૧૭૬/એ ( જુનો બ્લોક નં. ૧૭૬/એ , ૧૭૭ , ૧૭૯ અને ૧૯૬ ) અંદાજીત ક્ષેત્રફળ ૬૨૪૮૮ સબ પ્લોટ નં ૧ નો ફાઈનલ પ્લોટ નં. ૯૭+૧૦૧+૧૦૬/૨ નો ડ્રાફ્ટ ટો.પી. સ્કીમ નં. ૭૬ ( હાથીજણ ) જનો ચો.મી. અંદાજીત ક્ષેત્રફળ ૬૯૮૦.૪૨ ચો.મી. મોજે ગામ હાથીજણ, તાલુકા વટવા , અમદાવાદ જીલ્લો અને રજીસ્ટ્રેશન સબ - જીલ્લો અમદાવાદ-૧૧ ( અસલાલી ) ખાતે આવેલ છે અને તેની ચતુ :સીમા નીચે મુજબ છે : પૂર્વ ફ્લેટ નં. ડી/૫૦૪, પશ્ચિમ : બ્લોક - સી , ઉત્તર : ફ્લેટ નં. ડી/૫૦૨ , દક્ષિણ : બ્લોક - એફ

તારીખ : ૦૯.૦૫.૨૦૨૫ સ્થળ : જુના શારદા મંદિર નોંધ : વિવાદની સ્થિતીમાં આ નોટીસનો અંગ્રેજી અનુવાદ માન્ય ગણવામાં આવશે.

અધિકૃત અધિકારી દુવ્ણીવવ ભુસ